

## પત્રક—અ

હવામાન આગાહી આધારીત કૂષિ સલાહ બુલેટીન

( સમય તા : ૦૧.૨.૧૪ થી તા : ૦૫.૦૨.૧૪ )

પાછલા અઠવાડીયાનું હવામાન

હવામાન પરીબળો	કૂષિ આબોહવાક્ય વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્ર
વરસાદ (મીભી)	0.00
મહત્વમાન તાપમાન (સે.ગે.)	31.8
લઘુત્વમાન તાપમાન (સે.ગે.)	13.3
ભેજ(%) (સવાર/બપોરબાદ)	90-27
પવનની ગતિ (કિમી/કલાક)	3.3

## પત્રક-૬ : જિલ્લાવાર હવામાન આગાહી (તા.૦૫.૦૨.૧૪ સુધી)

હવામાન પરીબળોઅ	તારીખ	દક્ષિણ સૌરાષ્ટ્ર	
		જુનાગઢ	પોરબંદર
વરસાદ (મીમી)	૦૧.૨.૧૪	0	0
	૦૨.૨.૧૪	0	0
	૦૩.૨.૧૪	0	0
	૦૪.૨.૧૪	0	0
	૦૫.૨.૧૪	0	0
મહત્વમાન તાપમાન (સે.ગ્રે.)	૦૧.૨.૧૪	28	30
	૦૨.૨.૧૪	28	31
	૦૩.૨.૧૪	29	31
	૦૪.૨.૧૪	29	32
	૦૫.૨.૧૪	30	32
લઘુત્વમાન તાપમાન (સે.ગ્રે.)	૦૧.૨.૧૪	16	15
	૦૨.૨.૧૪	16	15
	૦૩.૨.૧૪	17	15
	૦૪.૨.૧૪	17	16
	૦૫.૨.૧૪	17	16
વાદળની સ્થિતિ (ઓક્ટો)	૦૧.૨.૧૪	મોટેભાગે ચોખ્યુ	મોટેભાગે ચોખ્યુ
	૦૨.૨.૧૪	અંશતઃ વાદળછાયુ	અંશતઃ વાદળછાયુ
	૦૩.૨.૧૪	અંશતઃ વાદળછાયુ	અંશતઃ વાદળછાયુ
	૦૪.૨.૧૪	ચોખ્યુ	ચોખ્યુ
	૦૫.૨.૧૪	મોટેભાગે ચોખ્યુ	મોટેભાગે ચોખ્યુ
મહત્વમાન ભેજ (%)	૦૧.૨.૧૪	55	50
	૦૨.૨.૧૪	54	51
	૦૩.૨.૧૪	61	63
	૦૪.૨.૧૪	72	78
	૦૫.૨.૧૪	66	69
લઘુત્વમાન ભેજ (%)	૦૧.૨.૧૪	40	33
	૦૨.૨.૧૪	43	37
	૦૩.૨.૧૪	48	44
	૦૪.૨.૧૪	52	47
	૦૫.૨.૧૪	50	46
પવનની ગતિ (કિમી/કલાક)	૦૧.૨.૧૪	015	014
	૦૨.૨.૧૪	009	010
	૦૩.૨.૧૪	023	021
	૦૪.૨.૧૪	020	019
	૦૫.૨.૧૪	018	016
પવનની દિશા (ડાચ્રી)	૦૧.૨.૧૪	60	50
	૦૨.૨.૧૪	50	50
	૦૩.૨.૧૪	360	60
	૦૪.૨.૧૪	350	40
	૦૫.૨.૧૪	350	40

**પત્રક-ક**  
**જિલ્લાવાર કૃષિ સલાહ**

પાકનું નામ	કૃષિ સલાહ		
જરૂર	<ul style="list-style-type: none"> <li>❖ જરૂરા કથીરીના નિયંત્રણ માટે પ્રોપેનોફોસ ૨૫ મીલી/ ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો.</li> <li>❖ જરૂરા વાદળણાચા હવામાન પરીસ્થીતીમા પાકમા ચરમી રોગના નિયંત્રણ માટે મેન્જોરેબ ૫૦ ગ્રામ/ અથવા ટ્રાઇસાઈક્લાઝોલ ૧૫ મીલી/ ૧૫ લિટર પાણી મા ભેળવી છંટકાવ કરવો.</li> <li>❖ વાદળણાચા હવામાનમા જુરાને પિયત આપવાનું મુલતવી રાખવું.</li> </ul>		
લસણ	<ul style="list-style-type: none"> <li>❖ લસણ ના પાક મા પાંદનો તરણાંનો ના નિયંત્રણ માટે હેક્ઝાફોનાઝોલ ૨૦ મીલી/ ૧૦ લિટર પાણી ભેળવી છંટકાવ કરવો</li> <li>❖ લસણ મા ફૂભિ ના નિયંત્રણ માટે વિઘે ૫ કીલો કારબોકુરેન પિયત પહેલા આપવું.</li> <li>❖ લસણ મા મુળના સુકારા માટે ટ્રાઇકોડરમા ૨.૫ કીલો/હેક્ટારે આપવું .</li> <li>❖ લસણમાં શ્રિપ્સના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણી મા ૧૦ મીલી ડાયમિથોએટ અથવા ટ્રાયઝોફોસ ૧૫ મીલી અથવા સ્પીનોસાડ ૩ મીલી ભેળવી તેનો છંટકાવ કરવો.</li> </ul>		
દક્ષિણ આબોહવાક્ય વિસ્તાર જેત	<td style="color: red;">કુંગળી</td> <td> <ul style="list-style-type: none"> <li>❖ કુંગળી ના પાક મા તડતડીયા ના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ દવા ૨૦મીલી /૧૦ લિટર પાણી મા ભેળવી છંટકાવ કરવો.</li> </ul> </td>	કુંગળી	<ul style="list-style-type: none"> <li>❖ કુંગળી ના પાક મા તડતડીયા ના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ દવા ૨૦મીલી /૧૦ લિટર પાણી મા ભેળવી છંટકાવ કરવો.</li> </ul>
ધાણા	<ul style="list-style-type: none"> <li>❖ પાકને કટોકટી અવસ્થાએ જમીન ની પ્રત ને ધ્યાને લઈ આવશ્યક પિયત આપવું.</li> </ul>		
કપાસ	<ul style="list-style-type: none"> <li>❖ પાકમા દાણાની માખીના નિયંત્રણ માટે કુલ આવ્યા પછી પંદર દિવસના અંતરે જરૂરીયાત મુજબ મિથાઈલ ઓ ડીમેટોન અથવા મિથાઈલ પેરાથીયોન ૧૦ મીલી દવા અથવા ડીડીવીપી ૫ મીલી/ ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો.</li> </ul>		
ચણા	<ul style="list-style-type: none"> <li>❖ લીલી ઈયળના નિયંત્રણ માટે એમામેક્ટીન બેન્જોએટ ૫ થી ૭ ટકા ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.</li> </ul>		
તુવેર	<ul style="list-style-type: none"> <li>❖ લીલી ઈયળના નિયંત્રણ માટે મોનોકોટોફોસ ૨૦ મીલી દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.</li> </ul>		
મેથી	<ul style="list-style-type: none"> <li>▪ મેથી ના પાકમા ભુકીણા ના નિયંત્રણ માટે સલ્ફર ૮૦ % wp ૫૦ ગ્રામ/૧૫ લિટર પાણી મા ઓગાળી છંટકાવ કરવો</li> </ul>		
ભીડો	<ul style="list-style-type: none"> <li>➢ ડુખ અને ફળ કોરી ખાનાર ઈયળ નીયંત્રણ માટે લીમ્બોળી ના બીજ નો ઔંક ૫૦૦ મીલી</li> </ul>		

	અથવા લીમ્બોળી નુ તેલ ૫૦ મીલી ૧૦ લિટર પાણી મા ઓગાળી ૧૫ દીવસ ના અંતરે ૪ છંટકાવ કરવો .
મરચા	✓ પાકમા સુકારાના રોગના નિયંત્રણ માટે ડ્રાઇકોડરમા વિરીડી ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમા ઓગાળી છોડ થડ પાસે ફેંચીગ કરવુ.
દાડમ	✓ દાડમ મા રસ ચુસનાર કુદા ના નિયંત્રણ માટે કંરજ તેલ, નેપાળો(રતન જ્યોત ) તેલ અથવા લીમ્બોળી નુ તેલ ૪૦ મીલી/ ૧૦ લિટર લિટર પાણી મા ઓગાળી છંટકાવ કરવો .
આંબો	ભુકીછારા રોગના નિયંત્રણ માટે હેકાકોનાજોલ ૧૫ મીલી/ ૧૦ લિટર પાણીમા મીશ્ર કરી છંટકાવ કરવો.
પશુપાલન	<ul style="list-style-type: none"> <li>❖ ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટાજ દવા ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો.</li> <li>❖ પશુઓને ઠડી થી રક્ષણ આપવા સુકાચારા નુ પ્રમાણ વધારવુ અને તેઓને શેડ મા રાખવા</li> </ul>

## JUNAGADH

**Phone: 0285-2670139**

**Date:31-1-2014**

**(Period 1 to 05 February -2014)**

### **Significant weather for the preceding week**

Rain fall (mm)	0.00
Maximum temperature °C	31.5-32.4
Minimum temperature °C	12.4-15.0
RH % (Morning/Afternoon)	90-27
Wind speed (Kmph)	2.9-3.8
Cloud cover	0-4

### **Weather forecast for Junagadh Dist. until 08:30 hrs of 05-02-2014**

Parameters	Day-1 01-02-14	Day-5 02-02-14	Day-5 03-02-14	Day-5 04-02-14	Day-5 05-02-14
Rain fall (mm)	0	0	0	0	0
Maximum temperature °C	28	28	29	29	30
Minimum temperature °C	16	16	17	17	17
Cloud cover (Okta)	2	4	3	0	1
RH % (Morning/After noon)	55-40	54-43	61-48	72-52	66-50
Wind speed (Kmph)	015	009	023	020	018
Wind direction(Deg)	60	50	360	350	350

### **Agro meteorological Advisories**

Crop	Stage	Agromet Advisories
Cumin	Reproductive	<ul style="list-style-type: none"> <li>▪ Due to cloudy whether condition there is a chance of Alternaria blight. For the these disease spray Mancozeb 40 g/ and Tricyclazol 15 ml/15 liter of water.</li> <li>▪ For the control of Aphid, Spray Diamethoate 25ml/15 liter of water.</li> <li>▪ Due to cloudy whether condition do not apply irrigation.</li> </ul>
Garlic	Bulb Development	<ul style="list-style-type: none"> <li>▪ For the control of Leaf blight, Spray Hexaconazol 20 ml/ 10 litre of water.</li> <li>▪ For the control of Thrips, spray Diamethoate 10ml or Triazophos 15 ml or Spinosad 3 ml/10 liters of water.</li> <li>▪ For the control of Nematode, drench of carbofuren 5 kg/vigha before irrigation.</li> <li>▪ For the control of stem rot, drenching of <i>Tichoderma</i> 1 kg/2.5 vigha.</li> </ul>
Wheat	Booting	<ul style="list-style-type: none"> <li>▪ Apply irrigation to crop after during booting stage.</li> </ul>
Coriander	Maturation	<ul style="list-style-type: none"> <li>▪ For the control of Pod fly Methyl O- Demeton or Methyl Parathion 10 ml or DDVP 5 ml/10 liter of water at Flowering time for 15 Days Interval.</li> </ul>
Cotton	Maturity	<ul style="list-style-type: none"> <li>▪ Picking of cotton should be carried out early in the morning.</li> </ul>
Chickpea	Pod development	<ul style="list-style-type: none"> <li>▪ For the control of pod borer, spray amamectin benzoate @ 7gm in 10 liters of water.</li> </ul>
Onion	Bulb Development	<ul style="list-style-type: none"> <li>▪ For the control of thrips, spray prophenophos @ 20ml in 10 liters of water.</li> </ul>

<b>Fenugreek</b>	Maturity	▪ For the control of Powdery mildew, spray Sulphur 80 % wp 50 gm/ 15 liter of water.
<b>Ladies Finger</b>	Fruiting	❖ For the control of Shoot and fruit borer, spray neem seed extract 500ml or neem seed oil 50 ml/10 liter of water at 15 days interval (total 4 spray).
<b>Chili</b>	Fruiting	❖ For the control of wilting disease, drenching of <i>Trichoderma viride</i> @40 gm/10 liter of water
<b>Pomegranate</b>	Fruiting	❖ For the control of fruit sucking moth, spray neem oil 40ml/10 lit. of water.
<b>Mango</b>	Flowering	❖ Due to cloudy weather there is a chance of powdery mildew disease, for the control of these disease spray hexaconazol 15 ml/10 liters of a water.
<b>Live stocks</b>	-	<ul style="list-style-type: none"> <li>➢ For the control of tick, spray Deltamathrin or Amitaz 20 ml/10 liter of water.</li> <li>➢ Increase the quantity of dry fodder.</li> <li>➢ Keep animal in shed to protect against cold.</li> </ul>

## PORBANDAR

**Phone : 0285-2670139**

**Date : 31-1-2014**

**(Period 01 to 05 February-2014)**

**Weather forecast for Porbandar Dist. until 08:30 hrs of 05-02-2014**

Parameters	Day-1 01-02-14	Day-5 02-02-14	Day-5 03-02-14	Day-5 04-02-14	Day-5 05-02-14
Rain fall (mm)	0	0	0	0	0
Maximum temperature °C	30	31	31	32	32
Minimum temperature °C	15	15	15	16	16
Cloud cover (Okta)	1	4	3	0	1
RH % (Morning/After noon)	50-33	51-37	63-44	78-47	69-46
Wind speed (Kmph)	014	010	021	019	016
Wind direction(Deg)	50	50	60	40	40

### Agro meteorological Advisories

Crop	Stage	Agromet Advisories
<b>Cumin</b>	Reproductive	<ul style="list-style-type: none"> <li>▪ Due to cloudy whether condition there is a chance of Alternaria blight. For the these disease spray Mancozeb 40 g/ and Tricyclazol 15 ml/15 liter of water.</li> <li>▪ For the control of Aphid, Spray Diamethoate 25ml/15 liter of water.</li> <li>▪ Due to cloudy whether condition do not apply irrigation.</li> </ul>
<b>Garlic</b>	Bulb Development	<ul style="list-style-type: none"> <li>▪ For the control of Leaf blight, Spray Hexaconazol 20 ml/ 10 litre of water.</li> <li>▪ For the control of Thrips, spray Diamethoate 10ml or Triazophos 15 ml or Spinosad 3 ml/10 liters of water.</li> <li>▪ For the control of Nematode, drench of carbofuren 5 kg/vigha before irrigation.</li> <li>▪ For the control of stem rot, drenching of <i>Tichoderma</i> 1 kg/2.5 vigha.</li> </ul>
<b>Wheat</b>	Booting	<ul style="list-style-type: none"> <li>▪ Apply irrigation to crop after during booting stage.</li> </ul>
<b>Coriander</b>	Maturation	<ul style="list-style-type: none"> <li>▪ For the control of Pod fly Methyl O- Demeton or Methyl Parathion 10 ml or DDVP 5 ml/10 liter of water at Flowering time for 15 Days Interval.</li> </ul>
<b>Cotton</b>	Maturity	<ul style="list-style-type: none"> <li>▪ Picking of cotton should be carried out early in the morning.</li> </ul>
<b>Chickpea</b>	Pod development	<ul style="list-style-type: none"> <li>▪ For the control of pod borer, spray amamectin benzoate @ 7gm in 10 liters of water.</li> </ul>
<b>Onion</b>	Bulb Development	<ul style="list-style-type: none"> <li>▪ For the control of thrips, spray prophenophos @ 20ml in 10 liters of water.</li> </ul>
<b>Fenugreek</b>	Maturity	<ul style="list-style-type: none"> <li>▪ For the control of Powdery mildew, spray Sulphur 80 % wp 50 gm/ 15 liter of water.</li> </ul>
<b>Ladies Finger</b>	Fruiting	<ul style="list-style-type: none"> <li>❖ For the control of Shoot and fruit borer, spray neem seed extract 500ml or neem seed oil 50 ml/10 liter of water at 15 days interval (total 4 spray).</li> </ul>
<b>Chili</b>	Fruiting	<ul style="list-style-type: none"> <li>❖ For the control of wilting disease, drenching of <i>Tricoderma viride</i> @40 gm/10 liter of water</li> </ul>

<b>Pomegranate</b>	Fruiting	❖ For the control of fruit sucking moth, spray neem oil 40ml/10 lit. of water.
<b>Mango</b>	Flowering	❖ Due to cloudy weather there is a chance of powdery mildew disease, for the control of these disease spray hexaconazol 15 ml/10 liters of water.
<b>Live stocks</b>	-	<ul style="list-style-type: none"> <li>➤ For the control of tick, spray Deltamathrin or Amitaz 20 ml/10 liter of water.</li> <li>➤ Increase the quantity of dry fodder.</li> <li>➤ Keep animal in shed to protect against cold.</li> </ul>